



Tatva Chintan Pharma Chem Limited
(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited)
(CIN:U24232GJ1996PLC029894)



Date: 16 August 2021

Ref No:-TCPCL/SEC/2021-22/00007

To,

<p>The General Manager, Corporate relationship department, BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort, Mumbai-400 001</p> <p>Scrip Code: 543321 Through: BSE Corporate Compliance & Listing Centre</p>	<p>The Manager, Listing department, National Stock Exchange of India Limited Exchange Plaza, C-1, Block-G, Bandra-Kurla, Complex Bandra(E), Mumbai-400 051</p> <p>Scrip Symbol: TATVA Through: NEAPS</p>
--	---

Dear Sir/Madam,

Sub: Publication of an extract of unaudited financial results of the Company for the Quarter ended on 30 June 2021 in newspapers

Pursuant to regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, we enclosed herewith copies newspaper publication of extract of unaudited financial results of the Company for the quarter ended on 30 June 2021, published in Financial Express (English edition) and Vadodara Samachar (Gujarati edition) on 15 August 2021.

Kindly take the same on record and disseminate to the public at large

For Tatva Chintan Pharma Chem Limited




Apurva Dubey
Company Secretary and Compliance Officer
Membership No: A-41130

Factory and Registered Office: Plot No. 502/17, G.I.D.C. Estate, Ankleshwar - 393 002, District: Bharuch, Gujarat, India.

SEZ Unit: Plot No. Z/103/F/1 and Plot No. Z/103/F/2, SEZ Area Part-2, Dahej - 392 130, District: Bharuch, Gujarat, India.

DSIR Approved R & D Centre: Plot No. 353, G.I.D.C., Makarpura, Vadodara - 390 010, Gujarat, India.

Telephone No: +91 75748 48533 / 34 **Fax:** +91 265 263 8533

E-mail: chintan@tatvachintan.com **Website:** www.tatvachintan.com

LORDS ISHWAR HOTELS LIMITED
 Reg. Off: Hotel Revival, Near Sayaji Garden, Kalaghoda Chowk, University Road, Baroda, Gujarat 390002. Tel: 0265 2793545, Fax: 0265 2792028, CIN: L55100G1985PLC008264, E-mail: info@lordsiswar.com, Website: www.lordsiswar.com

Extract of Standalone Unaudited Financial Results for the Quarter ended on 30th June, 2021
 (Rs. in Lac)

Particulars	Quarter ended 30.06.2021 (Unaudited)	Year ended 31.03.2021 (Audited)	Quarter ended 30.06.2020 (Unaudited)
Total income from operations	83.03	107.13	23.35
Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(16.39)	(1.12)	(32.35)
Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(16.39)	(1.12)	(32.35)
Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(31.97)	1.83	(41.02)
Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	-	-	(86.02)
Equity Share Capital	747.00	747.00	747.00
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year)	-	-	-
Earnings per equity share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	1. Basic: (0.43)	0.02	(0.55)
2. Diluted: (0.43)	0.02	(0.55)	

Note: The above is an Extract of the detailed format of Unaudited Financial Results for the quarter ended 30th June, 2021 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the said results is available on website of BSE Limited i.e. www.bseindia.com and on the Company's Website viz. www.lordsiswar.com.

For LORDS ISHWAR HOTELS LIMITED
 Sd/-
PUSHPENDRA BANSAI
 Managing Director (DIN: 00086343)

Place : Mumbai
 Date : 14th August, 2021

Hind Commerce Limited
 CIN : L51900MH1984PLC085440

Regd. Off: 307, Arun Chambers, Tardeo Road, Mumbai - 400 034, Tel. No. +91-22-4050 0100 website: www.hindcommerce.com email id: investor@hindcommerce.com

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED 30TH JUNE, 2021

PARTICULARS	3 months ended		Corresponding 3 months ended in the previous year
	Un-Audited	Audited	
	30.06.2021	31.03.2021	30.06.2020
Total income from operations	23.84	334.82	95.52
Net Profit / (Loss) for the period (before Tax Exceptional and/or Extra Ordinary items)	9.07	24.37	1.16
Net Profit / (Loss) for the period (before Tax after Exceptional and/or Extra Ordinary items)	9.07	24.37	1.16
Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extra Ordinary items)	8.77	15.53	1.42
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	73.66	155.32	90.47
Equity Share Capital	300.00	300.00	300.00
Reserves (including Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	971.17	-
Earnings Per Share (of 10/- each) (for continuing and discontinued operations)	0.29	0.52	0.05
Basic:	0.29	0.52	0.05
Diluted:	0.29	0.52	0.05

a. The above is an extract of the detailed format of financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on company's website (www.hindcommerce.com).

b. The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on August 13, 2021.

c. The limited review as required under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.

For Hind Commerce Limited
 Sd/-
UMESH LAHOTI
 MANAGING DIRECTOR (DIN 00361216)

Place : Mumbai
 Date : August 14, 2021

SHIVAGRICO IMPLEMENTS LIMITED
 CIN: L28910MH1979PLC021212

Regd. Office: A-1, Gz. Floor, Adinath Apartment 281, Tardeo Road, Mumbai 400007 (T)-91 22 23893022 / 23 Email id: shivagrigo@shivagrigo.in Website : www.shivagrigo.in

EXTRACT OF STANDALONE UN AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2021
 (In terms of Regulations 47 (1)(b) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.)
 (Rupees in Lakhs)

PARTICULARS	Quarter Ended as on		Year ended as on	
	30-06-2021 (Unaudited)	31-03-2021 (Audited)	30-06-2020 (Unaudited)	31-03-2021 (Audited)
Total income from operations (Net)	944.44	1,172.01	558.05	3,828.02
Net Profit/(Loss) for the period (before tax, exceptional and/or Extraordinary items)	28.04	14.81	-47.28	31.36
Net Profit/(Loss) for the period (before tax, after exceptional and/or Extraordinary items)	28.04	14.81	-47.28	31.36
Net Profit / (Loss) for the period after tax (after extra Ordinary items)	22.22	4.17	-37.01	9.90
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax))	22.22	4.27	-37.01	9.99
Equity Share Capital	501.36	501.36	501.36	501.36
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the previous year)	-	-	-	119.26
Earning Per Share (after extra Ordinary items)	0.44	0.08	(0.74)	0.20
Basic:	0.44	0.08	(0.74)	0.20
Diluted:	0.44	0.08	(0.74)	0.20

The above is an extract of the detailed format of quarterly Results for the period ended on 30th June, 2021 filed with the stock exchange (BSE Limited) under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly Financial Results are available in the "Investors" section of the company's website (www.shivagrigo.in) and on the stock exchange (www.bseindia.com).

For Shivagrigo Implements Limited
 Sd/-
Vimal Chand M. Jain
 Director

Place: Mumbai
 Date : 13-08-2021

THE BARODA RAYON CORPORATION LIMITED
 Reg. Office: P.O. Baroda Rayon, Fatehnagar, Udhna, Dist. Surat-394220 (T) 0261-2899555 Email-brcsurat@gmail.com | Website-www.brcl.in | CIN - L99999GJ1958PLC000892

Extract of Standalone Un-audited Financial Results for the Quarter ended 30th June, 2021
 (Rs in lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Year ended
		30.06.2021 (Un-audited)	31.03.2021 (Audited)	
1	Total income from operations (net)	-	-	-
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	684.96	(1194.36)	(11984.04)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	684.96	(1233.17)	(12365.85)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	684.96	(1233.17)	(12365.85)
5	Total comprehensive income for the period (comprising Profit/(Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	684.96	(1233.17)	(12365.85)
6	Equity Share Capital	2291.14	2291.14	2291.14
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Balance Sheet of the previous year	-	-	(37250.33)
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	2.99	(53.82)	(53.97)
	Basic:	2.99	(53.82)	(53.97)
	Diluted:	2.99	(53.82)	(53.97)

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats of the Quarterly Financial Results are available on the BSE website (www.bseindia.com) and company's website (www.brcl.in).

For The Baroda Rayon Corporation Limited
 Sd/-
Damodarhai Patel
 Managing Director | DIN-00056513

Place : Surat
 Date : 14-08-2021

TATVA CHINTAN PHARMA CHEM LIMITED
 (Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited)

CIN: U24232GJ1996PLC029894

Registered Office: Plot No. 502 / 17, GIDC Estate, Ankleshwar, Bharuch, Gujarat - 393 002
 Website: www.tatvachintan.com, E-mail: chintan@tatvachintan.com, Tel. No.: +91 75748 48533

EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2021
 (Rupees in millions, except per share data)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		30 June 2021 (Unaudited)	31 March 2021 (Unaudited)	30 June 2020 (Unaudited)	31 March 2021 (Audited)
1.	Total income from operations	1,068.32	1,086.67	515.32	3,003.59
2.	Net profit / (loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	242.61	242.39	83.36	606.96
3.	Net profit / (loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	242.61	242.39	83.36	606.96
4.	Net profit / (loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	231.46	211.19	67.10	522.62
5.	Total comprehensive income for the period (comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	230.38	212.34	67.20	524.09
6.	Equity share capital	200.88	200.88	80.35	200.88
7.	Reserves (excluding revaluation reserve) as shown in the audited balance sheet of the previous year	-	-	-	1,458.76
8.	Earnings per share (of Rs. 10/- each)	11.52	10.51	3.34	26.02
	1. Basic:	11.52	10.51	3.34	26.02
	2. Diluted:	11.52	10.51	3.34	26.02

KEY NUMBERS OF STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2021
 (Rupees in millions)

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		30 June 2021 (Unaudited)	31 March 2021 (Unaudited)	30 June 2020 (Unaudited)	31 March 2021 (Audited)
1.	Total income from operations	1,076.50	1,044.97	520.73	2,911.88
2.	Net profit before tax	249.79	232.26	97.34	593.48
3.	Net profit after tax	239.56	203.53	81.08	513.59
4.	Total comprehensive income	238.48	204.68	81.18	515.06

Notes:
 a) The above Consolidated & Standalone Financial Results for the quarter and year ended 30 June 2021, were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 14 August 2021.
 b) The above is an extract of the detailed format of Unaudited Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed Unaudited Quarterly Financial Results are available on the websites of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and also on the Company's website at www.tatvachintan.com
 c) Figures for the previous periods/year are re-classified/re-arranged/re-grouped, wherever necessary.

For and on behalf of the Board of Directors
Tatva Chintan Pharma Chem Limited
Chintan N. Shah
 Chairman and Managing Director
 DIN: 00183618

Place: Vadodra
 Date: 14 August 2021

A factors 236

HDFC MUTUAL FUND
 BHAROSA APNO KA

HDFC Asset Management Company Limited
 A Joint Venture with Standard Life Investments
 CIN: L65991MH1999PLC123027

Registered Office: HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676 Fax: 022 22821144 • e-mail: hello@hdfcfund.com • Visit us at: www.hdfcfund.com

NOTICE

NOTICE is hereby given that HDFC Trustee Company Limited, Trustee to HDFC Mutual Fund ("the Fund") has approved the following Distribution under Income Distribution cum Capital Withdrawal ("IDCW") Options in **HDFC Arbitrage Fund, an Open-ended Scheme investing in Arbitrage Opportunities ("the Scheme") and fixed Friday, August 20, 2021** (or the immediately following Business Day, if that day is not a Business Day) as the Record Date for the same:

Name of the Scheme / Plan / Option	Amount of Distribution (₹ per Unit)	Face Value (₹ per unit)	Net Asset Value ("NAV") as on August 13, 2021 (₹ per unit)
HDFC Arbitrage Fund - Wholesale Plan - Regular Plan - Normal IDCW Option (Payout and Reinvestment)	10.571		
HDFC Arbitrage Fund - Wholesale Plan - Direct Plan - Normal IDCW Option (Payout and Reinvestment)	10.894		
HDFC Arbitrage Fund - Wholesale Plan - Regular Plan - Monthly IDCW Option (Payout and Reinvestment)	10.926	10.00	
HDFC Arbitrage Fund - Wholesale Plan - Direct Plan - Monthly IDCW Option (Payout and Reinvestment)	10.599		

The distribution will be subject to the availability of distributable surplus on the Record Date and may be lower.

Pursuant to the Distribution, the NAV of the IDCW Option(s) of the above Scheme would fall to the extent of such distribution and statutory levy, if any.

Amount will be paid, net of applicable tax deducted at source (TDS), to those Unit holders / Beneficial Owners whose names appear in the Register of Unit holders maintained by the Fund / Statements of Beneficial Ownership maintained by the Depositories, as applicable, under the IDCW Option(s) of the aforesaid Scheme on the Record Date (including investors whose valid purchase / switch-in requests are received by the Fund and the funds are available for utilization before cut-off timings in respect of the aforesaid Scheme, on the Record date).

With regard to Unit holders who have opted for Reinvestment facility under the IDCW Option(s), the amount due (net of applicable TDS) will be reinvested, by allotting Units at the ex-Distribution NAV per Unit (adjusted for applicable stamp duty).

Unit holders who have opted to receive payout by way of physical instruments may experience delays on account of delivery constraints on the courier / postal services arising out of the unprecedented COVID-19 situation. Such Unit holders are advised to opt for payout through electronic mode(s) at the earliest due to the inherent benefits of such mode(s) as convenience of the credit of the distribution proceeds into their bank account directly as also avoiding loss of payment instruments in transit or fraudulent encashment. Please arrange to send us a copy of a cancelled cheque of your bank account to have the electronic payout mode enabled.

Intimation of any change of address / bank details should be immediately forwarded to the Investor Service Centres of the Fund (for units held in non-demat form) / Mediparty Participant (for units held in demat form).

In view of individual nature of tax consequences, each investor should seek appropriate advice.

For **HDFC Asset Management Company Limited**
 (Investment Manager to HDFC Mutual Fund)

Place : Mumbai
 Date : August 14, 2021

Sd/-
 Authorized Signatory

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

AU SMALL FINANCE BANK LIMITED
 A SCHEDULED COMMERCIAL BANK
 Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001 (CIN:L36911RJ1996PLC011381)

Demand Notice Under Section 13(2) of Securitisation Act of 2002

As the loan account became NPA therefore the Authorized officer under section 13(2) of "The Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002" had issued 60 days demand notice to the Borrowers/Co-borrowers/Mortgagors/Guarantors (collectively referred as "Borrowers") as given in the table. According to the notice if the borrowers do not deposit the entire amount within 60 days, the amount will be recovered from auction of the mortgage properties/secured assets as given below. Therefore you the borrowers are informed to deposit the entire loan amount along with future interest and expenses within 60 days from the date of demand notice, otherwise under the provisions of 13(4) and 14 of the said Act, the Authorized officer is free to take possession for sale of the mortgage properties/secured assets as given below. Borrowers to note that after receipt of this notice, in terms of Section 13(13) of the Act, 2002, you are prohibited and restrained from transferring any of the secured assets by way of sale, lease or otherwise, without prior written consent of the secured creditor. Borrowers attention are attracted towards Section 13(8) r/w Rule 3(5) of The Security Interest (Enforcement) Rules, 2002 Act that the borrowers shall be entitled to redeem their secured asset upon the payment of the complete outstanding dues as mentioned below before the publication of auction notice, which thereafter shall cease to exist.

Name of the Borrower / Mortgagor / Guarantor / Loan A/C No.	Date and Amount of Demand Notice Under Sec. 13(2)	Description of Mortgaged Property
(Loan A/C No.) L9001060118478868 Vedant Fish Corner-Through Its Proprietor Niranjan Vinayak Bhokare, Niranjan Vinayak Bhokare (Co-Borrower), Smt.Sushila Vinayak Bhokare (Co-Borrower)	13-Jul-21 ₹ 10,77,699/- Rs. Ten Lac Seventy-Seven Thousand Six Hundred Ninety-Nine only as on 07-Jul-21	Property Situated At S No 79 Plot No 11 Hissa No 01 Village Warale Pune Maharashtra 410507. Admeasuring 2100 Square Feet
(Loan A/C No.) L90010612121690 Siddhanath Tours And Travels (Borrower), Bibishan Mohan Bhakare (Co-Borrower), Madhuri Bibishan Bhakare (Co-Borrower)	13-Jul-21 ₹ 4,19,200/- Rs. Four Lac Nineteen Thousand Two Hundred only as on 07-Jul-21	Property Situated At Milkat No.230 Plot Of Bibishan 303 3 Floor Vighnaharta Sus Pune Maharashtra 411021. Admeasuring 411.43 Square Feet
(Loan A/C No.) L900106121172432 Smashtech Auto (Borrower), Afsar Babulal Sayyad (Co-Borrower), Babulal Badshah Sayyad (Co-Borrower)	13-Jul-21 ₹ 3,45,049/- Rs. Three Lac Forty-Five Thousand Forty-Nine only as on 07-Jul-21	Property Situated At Gat No 1651 Chikhali Pune Maharashtra 411062. Admeasuring 1000 Square Feet
(Loan A/C No.) L9001060120279935 M/S Traffic Jam Fast Food-Through Its Prop. Pramod Balu Balkawade, Pramod Balu Balkawade (Co-Borrower), Swati Pramod Balkawade (Co-Borrower)	13-Jul-21 ₹ 11,54,777/- Rs. Eleven Lac Fifty-Four Thousand Seven Hundred Seventy-Seven only as on 07-Jul-21	Property Situated At 91 Hissa No 2/3/3 Plot Of Swati Flat No 201 Second Floor Changbhale Heights Pimpale Gurav Pune Maharashtra 411061. Admeasuring 56.22 Square Metre
(Loan A/C No.) L9001060119855399 M/S Prasanna Enterprises-Through Its Prop.Vinod Bhiku Bhosale, Vinod Bhiku Bhosale (Co-Borrower), Sandhyarani Vinod Bhosale (Co-Borrower)	13-Jul-21 ₹ 32,49,911/- Rs. Thirty-Two Lac Forty-Nine Thousand Nine Hundred Eleven only as on 07-Jul-21	Property Situated At 4 Hissa No 1 Plot Of Vinod Kharadi Pune Maharashtra 411039. Admeasuring 1500 Square Metre
(Loan A/C No.) L900106121172282 Prasanna Enterprises (Borrower), Vinod Bhiku Bhosale (Co-Borrower), Sandhyarani Vinod Bhosale (Co-Borrower)	13-Jul-21 ₹ 6,43,309/- Rs. Six Lac Forty-Three Thousand Three Hundred Nine only as on 07-Jul-21	Property Situated At 4 Hissa No 1 Plot Of Vinod Kharadi Pune Maharashtra 411039. Admeasuring 1500 Square Metre
(Loan A/C No.) L9001060718677870 Sonal Boutique-Through Its It's Proprietor Ravindersingh Vijay Singh Pardeshi, Ravindra Vijaysingh Pardeshi (Co-Borrower), Sarita Ravindersingh Pardeshi (Co-Borrower), Virendrasingh Vijaysingh Pardeshi (Co-Borrower)	13-Jul-21 ₹ 28,78,992/- Rs. Twenty-Eight Lac Seventy-Eight Thousand Nine Hundred Ninety-Two only as on 07-Jul-21	Property Situated At S No 31 Plot Of Ravindrasingh Flat No 102 First Floor Maruti Complexhissa No 1 4A Old 1 4 1 1 Mundhwa Keshavnagar Pune Maharashtra 411036. Admeasuring 774 Square Feet
(Loan A/C No.) L9001060819564900 M/S Quoption Services-Through Its Proprietor Sumeet Ramesh Thite, Sumeet Ramesh Thite (Co-Borrower), Amit Ramesh Thite (Co-Borrower), Bharati Ramesh Thite (Co-Borrower)	13-Jul-21 ₹ 15,93,226/- Rs. Fifteen Lac Ninety-Three Thousand Two Hundred Twenty-Six only as on 07-Jul-21	Property Situated At 34 Hissa No 1 Plot. No. 19 Pune Corporation Kharadi Pune Maharashtra 411014. Admeasuring 2178 Square Feet
(Loan A/C No.) L9001060717684281 Aaliya Vegetable Suppliers (Borrower), Shakil Razzak Shaikh (Co-Borrower), Rajak Mansur Shaikh (Co-Borrower), Najama Rajjak Shaikh (Co-Borrower)	13-Jul-21 ₹ 20,02,983/- Rs. Twenty Lac Two Thousand Nine Hundred Eighty-Three only as on 07-Jul-21	(Property 1) Property Situated At Hissa No 3C 1 20 Plot Of Shakil Property Sr No 74 Mohammadwadi Pune Maharashtra 411048. Admeasuring 92.9 Square Metre (Property 2) S No 42 H No 1 6 10 Universal - Cluster Ft No 102 1 St Fr Komdhwa Bk Admeasuring 480 - Sqft
(Loan A/C No.) L900106121129050 Pardeshi Tours And Travels (Borrower), Gajraj Narayan Pardeshi (Co-Borrower), Rashmi Gujraj Pardeshi (Co-Borrower)	13-Jul-21 ₹ 5,51,949/- Rs. Five Lac Fifty-One Thousand Nine Hundred Forty-Nine only as on 07-Jul-21	Property Situated At S No 42 Flat Of Rashmi Flat No 102 First Floor Hissa No 1 6 10 Kondhava Khurd Pune Maharashtra 411001. Admeasuring 480 Square Feet
(Loan A/C No.) L9001060116497505 Gorakshanath Mulidhar Nagare (Borrower), Mahesh Gorakshanath Nagare (Co-Borrower), Gorakh Mulidhar Nagare (Co-Borrower)	13-Jul-21 ₹ 10,73,767/- Rs. Ten Lac Seventy-Three Thousand Seven Hundred Sixty-Seven Only as on 13-Jul-21	Property Situated At Shirampur Ahmednagar Maharashtra 413709. Admeasuring 125 - Sq.Mtr.
(Loan A/C No.) L900106121651617 Sagar Kirana Stores (Borrower), Sindhu Arvind Bhongale (Co-Borrower), Sagar Arvind Bhongale (Co-Borrower), Priyanjali Sagar Bhongale (Co-Borrower)	13-Jul-21 ₹ 1,22,895/- Rs. One Lac Twenty-Two Thousand Eight Hundred Ninety-Five Only as on 13-Jul-21	Property Situated At Piece And Parcel Of Property Of Cts No 352, & Cts No 353, Milkat No 0392 (Old Milkat No 0428) Shirur - Talegaon Dhamdhare, Taluka Shirur - Pune Maharashtra 412208. Admeasuring 52.1 Sq mtr + 59.4 Sq mtr
(Loan A/C No.) L900106121141963 Denim Hub (Borrower), Ravikant Tulshiram Bhagwat (Co-Borrower), Dinesh Prabhakar Baravkar (Co-Borrower)	21-Jul-21 ₹ 5,84,816/- Rs. Five Lac Eighty-Four Thousand Eight Hundred Sixteen only as on 21-Jul-21	Property Situated At Gram Panchayat Gat No 27 Milkat 2840 House No 27 Ne Kedgaon Grampanchayat Kedgaon Station Kedgaon Pune, Maharashtra. Admeasuring 10000 Sqyds
(Loan A/C No.) L900106121076588 Rajyog Gents Parlor (Borrower), Rajesh Chandrakant Pawar (Co-Borrower), Chandrakant Dnyanoba Pawar (Co-Borrower)	21-Jul-21 ₹ 4,95,593/- Rs. Four Lac Ninety-Five Thousand Five Hundred Ninety-Three only as on 21-Jul-21	(Property 1) Property Situated At Municipal Corporation Sr 493 2B 1 City Sr No 180 Shop No 14 Sukhwanai Paradise Gf Mauje Bhosari, Pune Maharashtra. Admeasuring 137 sqft (Property 2) PROPERTY SITUATED AT Municipal Corporation SR 497 2C 1 CITY SR NO 1833 SHOP NO 1883 1883 1 1883 11 Shop No 3 Gf Sarita Apartment D Wing Mauje, Bhosari Pune Maharashtra. Admeasuring 135 Sqyds
(Loan A/C No.) L9001060713474511 Sunil (Borrower), Deepa Sunil Jain (Co-Borrower),	26-Jul-21 ₹ 14,17,818/- Rs. Fourteen Lac Seventeen Thousand Eight Hundred Eighteen only as on 22-Jul-21	Property Situated At Flat Development Authority (Res/Comm) 603 175 2B Pune Fursungi Haveli Pune Maharashtra. Admeasuring 540 Sq. Ft./Sq. Yrd./Sq. Mtr.
(Loan A/C No.) L9001060118517529 Saipratik Chaha Cen (Borrower), Dattatraya Dnyaneshwar Bhalerao (Co-Borrower), Sandeep Dnyaneshwar Bhalerao (Co-Borrower)	26-Jul-21 ₹ 20,97,044/- Rs. Twenty Lac Ninety-Seven Thousand Forty-Four only as on 22-Jul-21	Property Situated At House Municipal Corporation Sr 493 2B 1 City Sr No 180 Shop No 14 Sukhwanai Paradise Gf Mauje Bhosari, Pune Maharashtra. Admeasuring 2000 Sq. Ft./Sq. Yrd./Sq. Mtr.
(Loan A/C No.) L9001060119850287 Vaishali Enterprise (Borrower), Vaishali Rajesh Nashikkar (Co-Borrower), Rajesh Sudhakar Nashikkar (Co-Borrower)	26-Jul-21 ₹ 7,24,298/- Rs. Seven Lac Twenty-Four Thousand Two Hundred Ninety-Eight only as on 22-Jul-21	Property Situated At House Municipal Corporation Pawar Wadi Dive Cts No 154 Saswad Purenar Pune Maharashtra. Admeasuring 445 Sq. Ft./Sq. Yrd./Sq. Mtr.
(Loan A/C No.) L9001060121580404 Vedant (Borrower), Pandurang Babusha Koyate (Co-Borrower), Chaitali Pandurang Koyate (Co-Borrower)	26-Jul-21 ₹ 26,20,801/- Rs. Twenty-Six Lac Twenty Thousand Eight Hundred One only as on 24-Jul-21	Property Situated At House Gunthewari Property Act 2012 S No 201 Koyte Niwas Umbare Navlakh Umbare Navlakh Maval Pune Maharashtra. Admeasuring 1500 Sq. Ft./Sq. Yrd./Sq. Mtr.
(Loan A/C No.) L9001060818750153 Jaiveer Dreeses (Borrower), Sunil Jain (Co-Borrower), Deepa Sunil Jain (Co-Borrower)	26-Jul-21 ₹ 5,62,024/- Rs. Five Lac Sixty-Two Thousand Twenty-Four only as on 22-Jul-21	Property Situated At Flat Binawat Paradies A Wing 6Th Floor Flat No 603 S No 175/2B 147 Fursungi

